

Going for broke?

The Shiv Sena allied with the BJP at a time when the latter was considered a political untouchable, their ties cemented by the AB Vajpayee-LK Advani engage ment with Balasaheb Thackeray despite the differences between them. Younger BJP leaders from Maharashtra including the late Pramod Mahajan and Gopinath Munde were always at hand to iron out any difficulties, reaching out to Manohar Joshi, Narayan Rane (then with the Shiv Sena) and the Thackeray cousins Uddhav and Raj as and when the need arose. But that era formally came to a close on Tuesday when the Shiv Sena announced the end of its alliance with the BJP for the Lok Sabha and Maharashtra Assembly elections scheduled for 2019. This separation was widely expected as the relationship between the two partie went South rather precipitately after the 2015 General Election since when Prime Minister Narendra Modi and BJP president Amit Shah have in a focused manner been working to expand the party's support base in Maharashtra to Shiv Sena president Uddhav Thackeray's growing discomfort. The issues between the two allies that have all added incrementally to this rupture are well-known — a bitter disagreement over the portfolios allocated to Shiv Sena members of the Maharashtra Cabinet headed by the BJP's Devendra Fadnavis as Chief Minister and his turning down flat his ally's demand for the post of Deputy Chief Minister; the seat-sharing formula for the last Assembly poll breaking down because the BJP was not willing to continue with the earlier arrangement wherein it got more seats for the Lok Sabha election and the Shiv Sena was the senior partner for the Assembly poll; the bitter falling out over the 2017 during election to the Brihanmumbai Municipal Corporation, In dia's richest civic body with the erstwhile allies contesting separately; and a string of historical tensions including the Shiv Sena not voting for the NDA candidate in both 2007 and 2012 presidential elections and the appointment of Nitin Gadkari, seen as close to Raj Thackeray, as the BJP president in 2010.

New Developments in **Construction Technologies**

have created disruptions for All' agenda, further enacross a number of industries hances the need for conwith some seeing a more significant impact than others. In real estate, technology has contributed to changing the purchase process quite significantly. Technological development can also be seen on site with a view to improve the construction process and delivery. While real estate companies have easily by these technological adspectrum, the adoption of while managing costs. construction technologies on Through sessions with intersite is relatively lower.

Management Institute endeavor to educate both (REMI)-The Government's leaders and professionals in added thrust on urban development, Smart Cities and on ments. (19-10)

Technological advances accomplishing the 'Housing struction technology to build quality at a significant scale. Additionally, under the new Act RERA, the onus is on the developer to deliver quality on time to avoid penalties and limit any defect liabili-

A number of our Clients continue to be overwhelmed national experts at our vari-Ms. Shubika Bilkha, Busi- ous programs and via interness head at The Real Estate national study tours, we the space on these advance-

LETTERS TO THE EDITOR

Status & Changing Roles of Women in Indian Society (67)

The recurring sexual assaults and harassment which these vulnerable women face are not isolated incidents but instead are grim elements of daily living, in which sexualised violence against the powerless is normalised and invisibilised. Sexual molestation is routine most nights for homeless women living on city streets, but these women fear the police the most. Dalit girls and women routinely suffer sexual abuse. Sexual exploitation is common against girls and women with intellectual disability living in institutions. Violence against women with disabilities is often lost in silences, because they are unable and powerless to communicate the acts of violence to which they are subject and there is none to listen.

Any number of legislation and adding more teeth to the existing acts will not act as a deterrent to the increasing incidents of atrocities on women and rising sexual offences against the children, it is only a responsible society which can bring about some hope and reverse the trend.


Male aggressors molest and harass with impunity because they are assured that the imbedded patriarchy of institutions of the criminal justice system will protect them. But the police, prosecutors and judges often carry other prejudices in addition to patriarchy, against disadvantaged castes and tribes, minorities, single women, slum dwellers, homeless people, migrants, disabled and mentally ill people, sex workers and sexual minorities, and against the poor in general. Women survivors of violence from these sections are even more likely to face entrenched institutional biases from the criminal justice system.

It is high time that we focussed on helping women to acquire the knowledge of laws to fight harassment, atroci ties and the suppression which they face in daily life. The media play a crucial role in shaping the national and international narrative around women's lives.

Vinod Chandrashekhar Dixit (AHMEDABAD)

Edi.: Chunilal S. Bhatt. Printer & Pub.: Mayur C. Bhatt. Place of Pub.: 201-2-8, Nandan Com., Opp. Mithakhali Rly Crossing, Mithakhali, Ahd-6 Place of Printing: Kewal Offset B-8, J.K Estate, Nr.Kalpnabhumi Estste,Opp.Ravi Estste,Nr. Dudheswar Natertank, Dudheswar, Ahd-4 Owner: Kalyani Pub. Pvt. Ltd.

India is one nation for all its citizens Environmental goals



Vinod Chandrashekhar Dixit Free-lance Journalist Ahmedabad

69 years back, a salute of 21 guns and the unfurling of the Indian National flag by Dr. Rajendra Prasad heralded the historic birth of the Indian

26th of January has become a red-letter-day in the history

of our nation. Celebrating Re-

public Day every year is the

great honour for the people

living in India as well as peo-

ple of India in abroad. The

word republic means a coun-

try that is ruled by people,

elected by the the people of

that nation. Atal Behari Vajpayee said "India has no

dearth of brave young men and women and if they get the

opportunity and help then we

can compete with other na-

tions in space exploration and

Though India became a free nation on August 15, 1947, it enjoyed the true spirit of Independence on January 26, 1950 when the Constitution of India finally came into force. Attaining independence and becoming a republic nation was the biggest challenge that India had to face in the 20th century.

The seeds for a republic were sown by Pt Jawaharlal Nehru in the Lahore session of the Indian National Congress, held in the midnight of December 31, 1929 - January 1, 1930. People who were

fighting for Independence of India took a pledge on the same day in 1930 at the ba

to achieve a complete inde-

pendence (means Poorna

Swarajya) of India. Which came true a day in 1947 on

came into force on 26th of

January in 1950, so we cel-

ebrate this day as the Repub-

lic Day every year. This year

in 2018, we are celebrating

'69th Republic day of India'.

So, we should not let go eas-

ily their all priceless sacrifices

and make this country a slave

country again under corrup-

tion, illiteracy, inequality and

The fundamental rights and

The Constitution of India

15th of August.



duties of the people of the Republic in India have been laid down in our constitution. Every citizen of India is equal in the eye of law, and no one

tion for all its citizens, whether they are Hindu, Muslims, Sikh or Christian. Let us on this make a great promise to preserve the sovereignty of the nation, and



BrahMos Aerospace, the weight and accuracy, its enor-

is to suffer because of religion, creed, caste, colour or race. Today is the best day when we should take an oath to preserve our country's real meaning, position, status and most importantly culture of humanity. During the British Rule, two great personalities such as Ma-Gandhi and Rabindranath Tagore gave the same message of peace, love, unity and equality.

Republic Day conveys a message that India is one na-

makers of BRAHMOS super-

rejoicing at the free growth of diversified talents and fulfillment of the hopes and aspirations of the nation as a

Let's begin with 'sab ka saath'. We have build a cohesive India, where no Indian has to live in apprehension or fear of the other. We need to lay a good foundation for nurturing goodwill and effective functioning of the various societies. With the line of B. R. Ambedkar "We are Indians, firstly and lastly."

mous kinetic energy would

blow depth targets to smith-

ereens, making it a strategic

weapon with conventional

warheads; with Indian join-

vertised range of 290km can

be increased to 600km and

so on. The question which

need more focus

brought little cheer for those it would add 2.5 to three bilwho cherished the environ- lion tonne of CO2 equivalent ment and forests as Union Finance Minister Arun Jaitely made no special announcement for these sectors, apart from ushering in the second phase of the national solar mission, besides providing 7,000 railway stations with solar power. The Budget last year also missed on major core issues pertaining to the environment and climate change, as a result of which, India slowed down considerably on environmental protection front. There is an urgent need to make up for the lost time and fresh, bold initiatives in the 2018-19 can help achieve just that. The 2018 Budget can set

the course for India to implement the Paris Agreement to which it is a signatory, along with other 197 nations. This will align India with the international efforts on climate change to limit global warming to two degree celsius, and ideally by 1.5 degree celsius. This is particularly important as the global average temperature rise is already going past one degree celsius and is further projected to go past the lower limit of the agreement by mid-century. Given this, the onus has now firmly shifted to the countries' pledges and as such, India cannot be seen fumbling on its commitments.

India, as a signatory to the Paris Agreement, committed that it would reduce carbon emission intensity by 30-35 per cent below 2005 levels by 2030. Additionally, India also agreed to increase non-fossil-fuel-based energy contribution from the current 30 per cent to 40 per cent.

The Union Budget of 2017 Moreover, India pledged that of carbon sinks, such as forests, besides mobilising funds - both domestic and international — to fulfill adaptation and mitigation goals.

These undertakings are quite substantial, ambitious and capital intensive and the fund being allocated to the environment Ministry are crucial in achieving these objectives, provided they are used effectively and in a timely manner. According to Economic Survey of India 2016, India's climate action by 2030 will cost the country \$2.5 trillion or over Rs 150 lakh crore at 2014-15 prices. In the 2017 Budget, fund allocation for the environment Ministry was been increased by about Rs 300 crore to Rs 2,657 crore in 2017-18.

In fact, since 2014, budgetary allocations have increased from Rs 1,599.24 crore to Rs 2,675.42 crore announced in the budget 2017-18. This constitutes an impressive increase of more than 67 per cent over three years. But the good news quickly turns adverse when one sees the area of expense. Revenue and operational expenditures have risen from Rs 1,531.88 crore in 2014-15 to Rs 2,635.39 crore in 2017-18.

On the other hand, capital expenditure in the form of schemes and programmes dropped by over 40 per cent from Rs 67.36 crore during 2014-15 to Rs 40.03 crore in the 2017-18. This puts India's climate change mitigation in serious handicap. Coal cess and the National Clean Energy Fund (NCEF) play a major role in India's climate action plan.

Real Estate looking for quality talent

one of them will fulfil her other social discrimination.

Republic on January 26, 1950. nks of Ravi river in the Lahore

Being a fresh graduate or consultants. an early stage professional adapted to the shift in con- vances, especially under- of different career disciplines sector remains largely oversumer behavior to the digital standing their applicability available, there is that inher- looked when determining a ent accompanying uncertainty in the constantly evolving job market of today. Additionally, despite some favourable initiatives, there exists a large supply and demand gap, with students ex- requirement of the sector pressing their frustration by way of limited employment opportunities and corporates looking for quality talent.

Shubika Bilkha, Business Head at The Real Estate Management Institute - REMI we offer over 15 specialised programs specially curated for the real estate sector. The typical employers who recruit students from our institute include developers, brokerage firms, property management companies, real estate online portals and property

Fraternal fratricide

For those conversant with the history of the Communist movement in India, the latest fratricidal episode within the Marxist fraternity over what the nature of its ties with the Congress Party, if any, should be, is eerily familiar. One only has to close one's eyes for a moment to hear it as an echo of the same argumentbetween the first General Secretary and builder of the Communist Party of India PC Joshi, and his doctrinaire successor BT Ranadive, which began in the 1940s and marked the beginning of the decline of what was once the second-strongest political force in India after the Congress. There is one crucial difference, though, between the ongoing Sitaram Yechury-Prakash Karat spat and the divergence of views (and consequent battle of attrition) between Joshi and Ranadive that ultimately led to the split in the Communist Party of India in 1964 from which the CPM emerged.

While graduates seem to trying to outline a long-term be focused on careers in the career path today is challeng- IT sector, finance, marketing, ing. While there are a number among others, the real estate viable career path. The real estate sector which is slated to be a \$180bn opportunity by 2022, has a current skill shortfall of 4 million core professionals with the total skill expected to be 75 million by 2022. (19-10)

sonic cruise missile, which completes 20 years on February 12, has many firsts to its credit. It is the first successful joint venture between ing the Missile Technology India and Russia; it has met Control Regime club, its admanufacturing and delivery timelines, a rarity for the Defence Research and Development Organisation (DRDO); it has been accepted by all three defence services — the Navy, Army and the Air Force; with its supersonic speed of 2.8 Mach, it is difficult to in-

tercept; given its speed, RADHE DEVELOPERS (INDIA) LIMITED

CIN: L45201GJ1995PLC024491 Regd. Office: 1st Floor, Chunibhai Chambers, Behind City Gold Cinema, Ashram Road, Ahmedabad-380009 Phone: +91 79-26583381 | Website: www.radhedevelopers.com | E-mail: secretarial@radheinfra.com

NOTICE

Pursuant to Regulation 29 read with Regulation 47 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements Regulations, 2015 (Listing Regulations), Notice is hereby given that a meeting o he Board of Directors of the Company is scheduled to be held on Friday, February 2, 2018, inter alia, to consider and approve Un-Audited Financia Results of the Company for the quarter and Nine-Months ended on Decembe

The said Notice may be accessed on the Company's website a www.radhedevelopers.com and may also be accessed on the Stock Exchange websites at www.bseindia.com.

Pursuant to this, the Company has decided that the close period (i.e. closure of trading window) would commence from 6:00 p.m. on January 25, 2018 and end 48 hours after the results are made public on February 2, 2018 For Radhe Developers (India) Limited

SACHETA METALS LIMITED

CIN: L27100GJ1990PLC013784

Regd. Office: Block No.33, Sacheta Udyognagar Village:

Mahiyal, Ta: Talod, Dist. Sabarkantha. Gujarat-383215

Email: - investors.grivences@sacheta.com

sachet@sacheta.com,PH:- 02770-221739, 221239

Pursuant to the provisions of Regulation 47 read with Regulation

33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements)

Regulation, 2015, notice is hereby given that a meeting of the

Board Of Directors of the Company is scheduled to be held or

Wednesday the 07th February, 2018 to consider and approve inter

alia, the Unaudited financial results for the quarter ended

Further, in terms of the SEBI (Prohibition of Insider Trading) Regu-

lations, 2015 read with Company's Code of Conduct, the Trading

Window for dealing in the securities of the Company shall remain

closed from 31st January, 2018 to 09th February, 2018 (both days

inclusive) for the director/officer/designated Persons of the

For, Sacheta Metals Limited

Satishkumar Shah

Managing Director

Place: Ahmedabad Date: January 25, 2018

31st December, 2017.

Date: - 25.01.2018

Place: - Mahiyal

Mukesh Chaudhan Company Secretary

begs an answer is this: Can BrahMos be called a Make in India project? While the short answer is yes, some explaining on the 2014 Make in India policy, as elucidated under the Defence Procurement Policy (DPP-2016), is necessary to qualify the assertion. To begin with, there is a sea

difference between Make in India and Create in India. The latter, as the name indicates, is about creating from scratch, including design (based on general staff requirements of defence services), making and testing of prototypes, creating the desired eco system by involving the national defence industry (to include both public and private sector companies), and most importantly, to continue with research to ensure that the system re-

mains competitive globally

with high end, cutting edge

or best technologies.

India's defence sector opportunity The ultimate proof of a According to the DPP-2016, successfully created weapon system lies in its exports. Since basic research is fundamental to creating and staying on top, it might be inintelligence alone, while the total research allocation of ity partner. This requirethe DRDO in the same year was a mere \$2.2 billion.

Make in India, on the other hand, is about proprocured weapon systems.

two basic criteria must be met. One, minimum 40 per cent indigenisation should be assured; this may or may not include technology teresting to know that China transfer. And two, under the in 2017, earmarked about Foreign Direct Investment (FDI) rules, the Indian com pany should be the majorment pre-supposes little transfer of core technologies', which in any case few counties would part with, gressive indigenisation of know-why to the recipient country.

SUNGOLD CAPITAL LTD [CIN: L65910GJ1993PLC018956]

Read off: House no. 7/13, opp White Tower, Station Road, Nandod, Rajpipla, Narmada – 393145. Corporate Off: B/618, 6th Floor, Jaswanti allied Business Centre, off: Ramchandra Lane extn, Malad (west), Mumbai - 400064

Website: www.sungoldcapitallimited.com Email: info@sungoldcapitallimited.com

NOTICE

NOTICE is hereby given that pursuant to regulation 47 read with Regulation 29 & 33 of SEBI (Listing Obligation and Disclosure Requirements), Regulations, 2015 that the meeting of the Board of Directors of the Company will be held on Tuesday, February 13, 2018 at the Corporate office of the Company inter alia, to consider and approve the Unaudited Financial Result for the quarter ended December 31, 2017.

For Sungold Capital Ltd

Place: Mumbai Date: 25.01.2018 (Company Secretary & Compliance Officer

CS Sowjanya Poojary

SYMBOLIC POSSESSION NOTICE FICICI Bank

ICICI Bank Limited Registered Office: ICICI Bank Tower, Near Chakli Circle, Old Padra Road, Vadodara- 390007, Gujarat. Corporate Office: ICICI Bank Towers, Bandra Kurla Complex, Bandra (E), Mumbai - 400051

The undersigned being the Authorized Officer of ICICI Bank Limited under the Securitisation, Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of the powers conferred under section 13 (12) read with Rule 3 of the Security Interest (Enforcement) rules 2002, issued demand notices upon the borrowers mentioned below, to repay the amount mentioned in the notice within 60 days from the date of receipt of the said notice.

The borrower having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken Symbolic Possession of the property described herein below in exercise of powers conferred on him/ her under Section 13(4) of the said Act read with Rule 8 of the said rules on the below-mentioned dates. The borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of

ı	ICI	CICI Bank Limited.								
	Sr. No.	Name of the Borrower/ Loan Account Number	Description of Property / Date of Symbolic Possession	Date of Demand Notice/ Amount in Demand Notice (Rs.)	Name of Branch					
		Heerabhai Nanubhai Desai/ Kantaben Hirabhai Rabari – LBPAA00001852280	Plot No. 25, Block No. 16 Govardhan Township, NR. Rajput Chhatralay, Parth Resi, T.P. Schem- 1, At Canal Rd, Vill- Gungadipati, Patan- 384/265/ January 22, 2018	July 06,2017 Rs. 9,14,021.68/-	Patan					

The above-mentioned borrowers(s)/ guarantors(s) are hereby given a 30 days Notice to repay the amount, else the mortgaged properties will be sold on the expiry of 30 days from the date of publication of this Notice, as per the provisions under the Rules 8 and 9 of Security Interest (Enforcement) Rules 2002.

Date: 25-January-2018 Place: Patan Authorized Officer ICICI Bank Limited

સંપાદકીય

દાવોસમાં મોદી છવાયા

દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી છવાઈ ગયા હતા. એમણે દુનિયા સામેના પડકારોથી માંડી ભારતની સમૃદ્ધ બનતી છબી સુધીની વાતને શાસ્ત્રોક્ત અને આજના સંદર્ભ સાથે વણી લીધી હતી અને એમણે સાથોસાથ ભારતને શોકેશ કરી એફડીઆઈ માટે દુનિયાને નોતરા પણ આપ્યા હતા. એમણે ૧૯૯૭માં અહી તત્કાલીન વડાપ્રધાન દેવ ગોવડાના પ્રવચનને યાદ કરી ૨૦૧૮ના ભારતની વાત કરતા મોદીએ જણાવ્યું હતું કે, ભારતની જીડીપી છ ગણી થઇ ગઈ છે. એમણે ગાંધીજીને યાદ કરી એફડીઆઈ માટે આમંત્રણ આપતા જણાવ્યું હતું કે, સારા સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને શાંતિ માટે ભારત પધારો. એમણે એફડીઓઈનો વિરોધ કરતા વિપક્ષની પણ આડકતરી ટીકા કરી હતી. એમણે કહ્યું કે ભારતમાં રેડ ટેપ નહી પણ રેડ કાર્પેટ પાથરવામાં આવી છે. નોટબંધી અને જીએસટીનો બચાવ કરતા કહ્યું હતું કે, અમે મોટા આર્થિક સુધાર કરવા તરફ ગતિ કરી રહ્યા છીએ અને આજે ભારતમાં રોકાણ કરવાનું વધુ આસાન બન્યું છે. મોદીએ ૩૦ વર્ષ બાદ બહુમતી સરકારને ચૂંટવામાં આવી એ વાત યાદ અપાવી અને પોતાની સરકાર દ્વારા જરીપુરાણા કાયદાઓની નાબુદીથી માંડી જન ધન ખાતાની વાત કરી પોતાની સરકારની પ્રશંસા કરી હતી.

ડીજીટલ ટેકનોલોજીનાં મહત્ત્વ પર ભાર મુક્તા એમણે કહ્યું કે, આજે ડાટા એ સૌથી મહત્વનં સાધન બન્યા છે અને સાયબર સરક્ષા તથા ડાટાનાં વધુ સારા સંતુલિત ઉપયોગની આવશ્યકતા ઉભી થઇ છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ એ બિનસરકારી સંગઠન છે અને એમાં દુનિયાભરના ટોચના દેશોના સીઈઓ ભાગ લે છે. એના સામે મોદીએ પોતાનું ભારત અને વિશ્વ અંગેનો દ્રષ્ટિકોણ રાખ્યો હતો. આ વખતના વિષયને આવરી લેતા એમણે જણાવ્યું કે, વિશ્વ બધા મતભેદો ભૂલી એક સાથે ચાલે એ જરૂરી છે અને આ કલ્પના ભારતે તો સદીઓ પહેલા કરી હતી. વસુધૈવ કુટ્રમ્બકમનો સંદેશ ભારતે જ વિશ્વને આપ્યો છે. કેટલાક દેશો ઉદારીકરણથી દૂર જઈ રહ્યા છે એ તરફ અંગુલીનિર્દેશ કરી એમણે કહ્યું કે, વિશ્વને જોડવાની બધા વાતો કરે છે પણ ઘણા દેશો પોતાના દેશને જ મહત્વ આપે છે. આતંકવાદ મુદ્દે એમણે ભારતની ભૂમિકા સ્પષ્ટ કરતા કહેલું કે, સારો કે ખરાબ આતંકવાદ એવા જુદા જુદા કાટલાં હોઇ જ ના શકે. આતંકવાદને ખત્મ કરવા બધાએ સાથે મળી કામ કરવું પડશે. મોદીએ ચીન અને પાકિસ્તાન બન્નેને આડે હાથ લઇ કહ્યું હતું કે, અમે કોઈના દેશમાં ઘૂસવાનો પ્રયત્ન કરતા નથી. ક્લાઈમેટ ચેન્જનો પણ એમણે ઉલ્લેખ કર્યો અને આખરમાં ભારતમાં પોતાની સરકાર સબ કા સાથ, સબ કા વિકાસ સુત્ર સાથે આગળ વધી રહી છે અને આ જ મંત્ર વિશ્વે સ્વીકારવો પડશે. વડાપ્રધાન મોદીની વિદેશ યાત્રાઓ અસરકારક રહે છે એનો વધુ એક પુરાવો દાવોસમાં પણ મળ્યો. એમણે વટભેર ભારતની ઉજળી છબી વિશ્વ સમક્ષ ૨જ કરી હતી.

આર્થિક અસમાનતા

ભારતમાં વધતી આર્થિક અસમાનતા ઘેરી ચિંતાનો વિષય છે. ગરીબી ઉન્મૂલન માટે કામ કરતી સંસ્થા ઓક્સફેમનાં એક અહેવાલ અનુસાર ભારતમાં વિતેલા વર્ષમાં જેટલું સંપતિ સર્જન થયું હતું તેમાંથી ૭૩ ટકા હિસ્સો તો દેશનાં માત્ર ૧ ટકા ધનવાન લોકોનાં હાથમાં જતો રહ્યો છે. જ્યારે તળિયાનાં ૬૭ કરોડ ભારતીયોને તો આ સંપતિનાં માત્ર ૧ ટકા એટલે કે એકસોમાં ભાગથી જ સંતોષ માની લેવો પડયો છે. ૨૦૧૬ના આ સર્વે અનુસાર ભારતનાં ૧ ટકા સૌથી અમીર લોકો પાસે દેશની સંપતિનો ૫૮ ટકા હિસ્સો હતો. આપણાં દેશમાં આટલી ઝડપી વધી રહેલી આર્થિક અસમાનતા દુનિયાનાં નામાંકિત અર્થશાત્રીઓને પણ ચકિત કરી મુકે છે. દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમનું વાર્ષિક સંમેલન શરૂ થાય તેનાં કેટલાંક કલાક પહેલા જ જારી થયેલા આ રિપોર્ટ અનુસાર દુનિયાનાં અન્ય ભાગોની સ્થિતિ પણ સારી નથી. ગત વર્ષમાં દુનિયાની સંપતિમાં થયેલા કલ વધારામાં ૮૨ ટકા હિસ્સો માત્ર એક ટકા ધનાઢ્યોને મળી છે. જ્યારે ૩.૭ અબજ લોકોની સંપતિમાં તો કોઈ જ વધારો નથી થયો. ઓક્સફેમનાં વાર્ષિક સર્વે માટે સમગ્ર વિશ્વમાં ભારે ઉત્સુકતા હોય છે. તેનાં ઉપર વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં પણ ચર્ચા થતી હોય છે. આવકની અને લૈંગિક અસમાનતા જેવા મુદ્દા આ સંમેલનનાં એજન્ડામાં સામેલ હોય છે. જો આ વખતે પરિષદમાં આર્થિક અસમાનતા ઘટાડવા માટે કોઈ ચર્ચા થાય અને તેમાંથી કોઈ માર્ગ નીકળે તો તેને સાર્થક સમજવામાં આવશે. આર્થિક અસમાનતાનાં કારણે જ આજે ચોમેર આમજનતામાં ભારે આક્રોશ છે. તેની અભિવ્યક્તિ અરાજક અને હિંસક પ્રદર્શનો દ્વારા થાય છે. અમીરો પાસે ધન એકત્ર થવાનું સૌથી મોટું નુકસાન એ થાય છે કે સંપતિનો મોટો હિસ્સો બિનઉત્પાદક થઈને અર્થતંત્રનાં પ્રવાહમાંથી બહાર નીકળી જાય છે. ઉત્પાદન કે ઉપભોગમાં તેનું પછી કોઈ યોગદાન રહેતું નથી. તેનાથી વિકાસદરને પણ કોઈ ગતિ હાંસલ થતી નથી. કરોડો રૂપિયાની ગાડીઓ, લાખોની ઘડિયાળ અને પેન, બિટકોઈન જેવી આભાસી મુદ્રામાં રોકાઈ જતાં આવા નાણાંથી પછાત દેશોમાં કોઈ રોજગારી સર્જાય છે? ઓક્સફેમનાં અહેવાલને એક અર્થમાં ઉદારીકરણ અને વૈશ્વિકરણ ઉપર કરવામાં આવેલી આકરી ટિપ્પણી પણ માની શકાય તેમ છે.

દુનિયામાં મૂડીનો પ્રવાહ માત્ર એવા વર્તૂળને થઈ રહ્યો છે જે પહેલાથી જ સમૃદ્ધ છે. નવી વ્યવસ્થાઓમાં સરકારની ભૂમિકા ઘટતાં રાજકારણ પણ ગરીબો માટેં નીતિ ઘડતરને બદલે તેને ભરમાવવા ઉપર વધુ કેન્દ્રિત બની ગયું છે. ત્યારે હવે ફરીથી વર્લ્ડ ઈકોનોમિક ફોરમ જેવા આંતરરાષ્ટ્રીય મંચ ઉપર તેની ગહન ચર્ચા થાય અને કોઈ સાચી દિશાનાં ઉકેલ શોધવા માટે પ્રયાસો હાથ ધરાય તે આવકાર્ય બનશે.

હાફિજ સઇદનાં ઓવારણાં લઇને પાક વડાપ્રધાને હદ કરી નાખી

આતંકવાદને પોષવાના મામલે અમેરિકાનાં આકરાં પગલાંનો સામનો કરતા રહેલા પાકિસ્તાને તેના વલણમાં જો કે કોઇ સુધારો કર્યો હોય તેમ જણાતું નથી. અમેરિકા દ્વારા લશ્કરી સહાયતા બંધ કરવાનાં પગલાં બાદ પાકિસ્તાન આતંકવાદના મામલે ખરા અર્થમાં ગંભીર બનશે એવી અપેક્ષા વિશ્વ સમુદાયને હતી પણ પાકિસ્તાની શાસકોએ લાજવાને બદલે ગાજવા જેવો તાલ કર્યો છે. અમેરિકાની સામે પોતે આતંકવાદના મામલે પાકસાફ હોવાનું ગાણું ગાવાનું અને ઊલટું અમેરિકા તેના આતંકવાદની સામેના સહકારને બિરદાવતું ન હોવાનો રોષ વ્યક્ત કરવાનું શરૂ કર્યું છે. આ બધું ઓછું હોય તેમ ભારતમાં આતંકવાદી હુમલા માટેના મુખ્ય માસ્ટરમાઇન્ડ હાફ્રિઝ સઇદની સામે આતંકવાદ અંગે ઘરઆંગણે કોઇ પુરાવા ન હોવાનો ખુદ પાકિસ્તાનના વડાપ્રધાન શાહિદ અબ્બાસીએ દાવો કરીને પોતાના દેશનો વાસ્તવિક ચહેરો વિશ્વ સમક્ષ વધુ એક વખત છતો કર્યો છે, સાથોસાથ પાકિસ્તાની વડાપ્રધાને સઇદના સંબોધન માટે માનવાચક સાહબ શબ્દનો ઉપયોગ કરીને નક્ફટાઇની તમામ મર્યાદાઓનો લોપ કર્યો છે. પાકિસ્તાની વડાપ્રધાનનું આવું વલણ હાંસીપાત્ર ઠરે તેવું છે. એટલા બધા પુરાવા ઉપલબ્ધ છે જે સીધી રીતે સાબિત કરે છે કે મુંબઇના આતંકી હુમલાની સાથોસાથ ભારતમાં ત્રાસવાદના અન્ય બનાવોમાં સઇદનો હાથ હતો. આટલા પુરાવાને પાકિસ્તાન સતત નકારતું રહ્યંઅ છે. આવા ઇન્કાર દ્વારા તે વિશ્વની સામે એવો દેખાવ કરવાનો પ્રયાસ કરતું રહે છે કે તેને ત્યાં આતંકવાદની માટે કોઇ સ્થાન નથી.

> Edi:Chunilal S. Bhatt, Printer & Pub. : Mayur C. Bhatt, Place of Pub.: 201-2-8, Nandan Compllex,Opp. Mithakhali Rly Crossing, Mithakhali, Ahmedabad-6 Place of Printing Mahadev Offset, B-4 Ravi Estate, Rustam Mill Compound Dudheshwar, Ahmedbada-4. Owner : Kalyani Pub. Pvt. Ltd.

બંધનું એલાન પાછું ખેંચવા બદલ વિવિધ સંગઠનોનો આભાર માનતા ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા

રાજયમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ તમામ સંગઠનોનો આભાર માન્યો શાંતિ જાળવવા અને વિકાસની ગતિ જાળવી રાખવા પ્રાર્થના કરી હતી.

ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નિર્દેશ મુજબ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહજી ચૂડાસમાએ જાળવણી માટે રાજય સરકારે તા.૧૩/ આજે વિવિધ સંગઠનો સાથે બેઠક ૦૧/૨૦૧૮ના જાહેરનામાથી આ કરીને શાંતિપ્રિય ગુજરાત રાજયની શાંતિ ન જોખમાય એ માટે આવતીકાલનું ગુજરાત બંધનું એલાન કોર્ટમાં રીટ પીટીશન (સીવીલ) પાછું ખેંચવા વિનંતી કરી હતી. રાજય નં.૩૬/૨૦૧૮ થી રાજય સરકારના સરકારની આ અપીલનો સ્વીકાર જાહેરનામાને રદ કરવા દાદ માંગવામાં કરીને તમામ સંગઠનોએ બંધનું એલાન આવી હતી. નામદાર સુપ્રિમ કોર્ટે પાછું ખેચ્યું છે તે માટે હું તમામ તા.૧૮/૦૧/૨૦૧૮ના હુકમથી સંગઠનોનો આભાર માનું છું.

ફિલ્મ પદ્માવત ને લઇને રાજયમાં પગલાં લીધાં છે. રાજયમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે અને શાંતિ ન જોખમાય તે માટે રાજય સરકાર પ્રતિબધ્ધ છે એમ કહીને લેનાર તત્વો સામે કડક કાર્યવાહી

જાન્યુઆરીના ગુજરાત બંધના ફિલ્મનાં પ્રદર્શન પર તા.૨૨/૧૧/ મુકેલ હતો.

નવા નામથી આ ફિલ્મ તા.૨૫/ હતો. તેમણે ગુજરાતના નાગરિકોને ૦૧/૨૦૧૮ના રોજ પ્રદર્શિત થવાની જાહેરાત કરવામાં આવતાં ક્ષત્રિય સમાજના વિવિધ સંગઠનો દ્વારા આ ફિલ્મને પ્રદર્શિત નહીં કરવા અંગે વિરોધ તથા દેખાવો કરવામાં આવ્યા. જેથી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતીની ફિલ્મ પર પણ પ્રતિબંધ મુકયો હતો. ફિલ્મના નિર્માતાઓ દ્વારા સુપ્રિમ રાજય સરકારના તા. ૧૩/૦૧/ ૨૦૧૮ના જાહેરનામાને રદબાતલ જે સ્થિતિ સર્જાઇ છે તે પ્રત્યે રાજય ઠેરવેલ છે. આવી પરિસ્થિતી પછી સરકારે ખબ જ સંવેદનશીલતાપર્વક તા.૨૦/૦૧/૨૦૧૮ના રોજ રાજયની કાયદો અને વ્યવસ્થાની સ્થિતી અંગે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી ચર્ચા-વિચારણા કરીને કાયદો હાથમાં

ગુજરાત સરકારની અપીલને મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કરવા પણ ગૃહ રાજયમંત્રીશ્રી પરિસ્થિતીનું આકલન કરી તકેદારીના જીલ્લાઓની જવાબદારી સોપવામાં જણાવ્યું હતું કે, રાજયમાં આ ફિલ્મના ગ્રાહય રાખીને તા.૨૫મી હતું કે, રાજય સરકારે રાજયમાં આ પ્રદિપસિંહ જાડેજોએ સુચનાઓ આપી હતી. રાજયના અધિક મુખ્ય સચિવ એલાનને પાછુ ખેંચવા બદલ ગૃહ ૨૦૧૭ના જાહેરનામાથી પ્રતિબંધ (ગૃહ) શ્રી એમ.એસ. ડાંગુરે આજે પત્રકારોને સંબોધતાં જણાવ્યું હતું કે, રાજયના મુખ્ય સચિવશ્રી દ્વારા તમામ પોલીસ કમિશ્નરશ્રીઓ, તમામ રેન્જના વડાઓ. તમામ જિલ્લા મેજીસ્ટેટશ્રીઓ તથા તમામ પોલીસ અધિક્ષકશ્રીઓ સાથે રાજયની પરિસ્થિતી અંગે વિડીયો કોન્ફરન્સથી ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. મુખ્ય સચિવશ્રીએ પોલીસ પેટ્રોલીંગ વધારવા, જિલ્લા-રાજય હાઈવે પર વાહન વ્યવહાર અવિરતપણે ચાલુ રહે તે સુનિશ્ચિત કરવા, સંવેદનશીલ વિસ્તારોમાં વધુ તકેદારી રાખવા, અસામાજીક તત્વો સામે અટકાયતી પગલાં લેવા તેમજ કાયદા અનુસાર ગુના દાખલ કરી ધરપકડની કાર્યવાહી કરવા જિલ્લા સત્તાવાળાઓને સુચના આપી હતી. આ ઉપરાંત સિનેમાગૃહોને પુરતુ પોલીસ રક્ષણ પણ પરૂ પાડવામાં આવ્ય છે. જે રૂટ પર એસ.ટી. બસોને નુકશાન કરવામાં આવ્યું છે તે રૂટ પર ફરી આવા બનાવ ન બને તે આશયથી એસ.ટી. સેવા બંધ કરવામાં આવી હતી. સ્ટેટ આઈ.બી.ને તેના આગવા

પગલાં લેવા સંબંધિતોને નિયમિતપણે સચના આપવામાં આવી રહી છે. શ્રી ડાગુરે જણાવ્યું હતું કે, ગૃહ વિભાગ દ્વારા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠકો યોજી પરિસ્થિતીની સતત સમીક્ષા કરવામાં આવી રહી છે.

રાજયના પોલીસ મહાનિદેશક શ્રી પ્રમોદ કુમારે રાજયમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતીની અને રાજય સરકારે લીધેલાં પગલાંની વિગતો આપતાં જણાવ્યું હતું કે, તોફાની તત્વો સામે અત્યાર સુધીમાં કુલ ૫૪ ગુના નોંધીને ૧૧૮ આરોપીઓની ઘરપકડ કરવામાં આવી છે. પોલીસ વિડીયોગ્રાફ્રીના ફુટેજ અને આધારે તોફાની તત્વો સુધી પંહોચી રહી છે. અત્યાર સુધીમાં ૩૦૦ થી વધ લોકોને ડીટેઇન કરવામાં આવ્યા છે.

આવતીકાલે. તા.૨૫મી જાન્યુઆરીએ રાજયમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જાળવાઇ રહે અને ગુજરાતની શાંતિ ન જોખમાય તેમજ જનજીવન રાબેતા મુજબ રહે તે હેતુથી ગૃહ વિભાગે પુરતી તકેદારી રાખી છે. શ્રી પ્રમોદકુમારે જણાવ્યું હતું કે, આઇ.જી. અને ડી.આઇ.જી. કક્ષાના ૬ ઉચ્ચ અધિકારીઓને વિવિધ

૪૧ પોલીસ ઇન્સ્પેકટર્સ અને ૧૫૦ લોકરક્ષકો અને ૧૦,૦૦૦થી વધુ હોમગાર્ડસ અને ગ્રામ રક્ષક દળના જવાનોને તહેનાત કર્યા છે.

શ્રી પ્રમોદકુમારે જણાવ્યું હતું કે, આગોતરા પગલાં તરીકે રાજયમાં અર્ધ આવી છે. બી.એસ.એફ.ની ૬ કંપનીઓ અને રેપીડ એકશન ફોર્સની ૯ કંપનીઓ તથા સીમા સુરક્ષા દળની સી.સી.ટી.વી.માં ઝીલાયેલા દશ્યોના ૧ કંપનીની મદદ લેવામાં આવી છે. આ ઉપરાંત એસ.આર.પી.ની. ૯ પર તહેનાત પોલીસ ફોર્સને કારણે કંપનીઓ તહેનાત કરવામાં આવી છે.

કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જાળવવા પોલીસ પ્રેટ્રોલીંગ માટે વધારાના ૬૨૪ વાહનો રેકવીઝીટ કરવામાં આવ્યા છે. હાલમાં પેટોલીગ માટે ૮૭૩ વાહનો ઉપયોગમાં લેવાઇ પણ રાખવામાં આવ્યા છે. જેથી તોફાની તત્વોને ઓળખી શકાય. વિગતો આપતાં શ્રી પ્રમોદકુમારે

આવી છે. ૨૦ ડી.વાય.એસ.પી.. પ્રદર્શનના વિરોધ સંબંધમાં દેખાવો. રેલીઓ, સભાઓ થયેલ છે તેમજ થી વધુ પોલીસ સબ ઇન્સ્પેકટર્સને વિવિધ સ્થળોએ જાહેર રસ્તાઓ ઉપર સંવેદનશીલ વિસ્તારોમાં ડિપ્લોય ચક્કાજામ કરી વાહન વ્યવહારને કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સ્થગિત કરવાના પ્રયાસો કરવામાં પોલીસ વિભાગે ૯,૦૦૦ થી વધુ આવ્યા છે. દેખાવો દરમ્યાન કુલ ૨૧ S.T./B.R.T.S./AMTS બસોને સળગાવીને- તોડફોડ કરીને નુકશાન કરવામાં આવ્યું છે.

શ્રી પ્રમોદકુમારે જણાવ્યું હતું કે, ગઇ કાલે, તા.૨૩મી જાન્યુઆરીની લશ્કરી દળોની મદદ પણ લેવામાં રાત્રે અમદાવાદમાં જે બનાવો બન્યા તે ઘણા કમનસીબ છે. પરંત પોલીસની સમયસૂચકતા અને સજાગતાને કારણે ગંભીર ઘટનાઓ બનતી અટકાવી શકાઇ છે. અમદાવાદના વિવિધ મોલ તોફાની તત્વો મોલમાં પ્રવેશી શકયા ન હતા. એટલું જ નહી ૨૮ જેટલા તોફાની તત્વોને સ્થળ પરથી જ પકડી શકાયા હતા. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, આવતીકાલે રાજયમાં શાંતિ જળવાઇ રહે અને કાયદો-વ્યવસ્થા જળવાઇ રહે રહયા છે. શ્રી પ્રમોદ્કમારે જણાવ્યું હતું તે માટે ગૃહ વિભાગે વ્યુહાત્મક કે, પ્રેટ્રોલીગ વાહનોમાં વિડીયોગ્રાફર કામગીરી કરીને પુરતો પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે. આજે અમદાવાદ અને સંવેદનશીલ શહેરોમાં અર્ધ લશ્કરી દળોએ ફ્લેગ માર્ચ પણ કરી હતી.

ખરેખર આપણા દેશમાં સાચી

'પદ્માવત' ફિલ્મને આખરે સુપ્રીમ કોર્ટે લીલી ઝંડી આપી દીધી. સેન્સર બોર્ડે તો 'પદ્માવત'ને પહેલાં જ મંજૂરી આપી દીધેલી પણ રાજપૂત સમાજ તો આપણા રાજકારણીઓ જવાબદાર વંકાયેલો છે તેમાં કોકડું ગુંચવાઈ છે. 'પદ્માવત'નું નામ 'પદ્માવતી' હતું ગયેલું. આ મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો ત્યારે આશા હતી કે સુપ્રીમ કોર્ટ ફરમાન કરશે એટલે બધું ટાઢું પડી જશે. તેનું કારણ એ કે આપણે ત્યાં સુપ્રીમ કોર્ટ સર્વોપરી છે ને કાયદાના ફિલ્મને રિલીઝ કરવા દેવી કે નહીં એ અમલના મામલે સુપ્રીમ કોર્ટ કહે પછી બધાંએ તેની વાતને આદર આપવો એવો વણલખ્યો શિરસ્તો છે.

આ શિરસ્તો અત્યાર લગી પળાતો રહ્યો છે પણ રાજપુતોનો 'પદ્માવત' ફિલ્મ સામેનો વાંધો એટલો પ્રબળ છે કરતા હોય છે. આ એક સરકારે કે તેમણે સુપ્રીમ કોર્ટના આદેશની બનાવેલી કાનુની વ્યવસ્થા છે ને એ ઐસીતૈસી કરીને એલાન કરી દીધું છે કે. સુપ્રીમ કોર્ટ કહે કે બીજું કોઈ કહે, 'પદ્માવત' ફિલ્મ રિલીઝ નહીં થવા દેવાય એટલે નહીં થવા દેવાય. જે નિર્ણયો મતબૅક્રને ધ્યાનમાં રાખીને ભડાકા કરી લેવા હોય એ કરી લે પણ 'પદ્માવત' નહીં બતાવવા દેવાય એટલે નહીં જ બતાવવા દેવાય. આ એલાનના કારણે સુપ્રીમ કોર્ટની લીલી ઝંડી પછીય કકળાટ પત્યો નથી. બલ્કે નવેસરથી કકળાટ શરૂ થયો છે ને 'પદ્માવત' સામે તલવાર તાણીને મેદાનમાં પડેલા રાજપૂતોનાં સંગઠનો એકદમ આકરા પાણીએ આવી ગયાં

'પદ્માવત' ફિલ્મ સામે રાજપૂતોનાં ઢગલો સંગઠનો વિરોધમાં છે પણ તેમની આગેવાની કરણી સેનાએ લીધી છે. 'પદ્માવત' ફિલ્મ ૨૫ જાન્યુઆરીએ રિલીઝ થવાની છે ને કરણી સેનાએ એ દિવસે દેશભરમાં બંધ રાખવાનું એલાન પણ કરી નાંખ્યું છે. બીજાં સંગઠનોના તેવર પણ એવા જ છે ને આ સંગઠનો આર યા પારના મુડમાં આવી ગયાં છે. હાકલા-પડકારા થઈ રહ્યા છે ને 'પદ્માવત' ફિલ્મ રિલીઝ કરનારાં થિયેટરોને સળગાવી દેવાની ધમકીઓ પણ અપાઈ ગઈ છે. 'પદ્માવત ચલેગા તો દેશ જલેગા' એવા મેસેજ પણ ખુલ્લેઆમ અપાઈ રહ્યા છે ને કેટલાક અતિ ઉત્સાહી જીવડા તો 'પદ્માવત' ફિલ્મની રિલીઝ રોકવા માટે ફાંસીએ ચડી જવા ને શહાદત માટે પણ તૈયાર હોવાના ધખારા પણ બતાવી રહ્યા છે.

ભારતમાં ફિલ્મો સામેનો વિરોધ નવો નથી ને ભૂતકાળમાં ઘણી ફિલ્મો સામે કકળાટ થયો છે. ભૂતકાળમાં ઘણી વાર ફિલ્મની રિલીઝને રોકવા માટે છિયેટરમાં તોડફોડ કરાઈ હોય કે પછી મારઝૂડ થઈ હોય એવું બન્યું છે. આમીર ખાનની 'ફના' તો ગુજરાતમાં રીલીઝ જ નહોતી થઈ શકી. બીજાં પણ આવાં ઢગલો ઉદાહરણ છે તેથી ફિલ્મો સામેનો કકળાટ નવો નથી પણ 'પદ્માવત' સામે થયો એવો કકળાટ કોઈની સામે થયો નથી તેમાં મીનમેખ નથી. અત્યારે જે સ્થિતી સર્જાઈ છે તેવી

સંજય લીલા ભણશાળીની સ્થિતિ આ પહેલાં કોઈ ફિલ્મના કારણે નથી સર્જાઈ એ પણ કબલવું પડે.

> આ સ્થિતિ ખરેખર દુ:ખદ કહેવાય ને આ સ્થિતિ સર્જાઈ તેને માટે ખરેખર ત્યારથી જ રાજપુત સંગઠનો તેની સામે પડેલાં ને ખરેખર તો એ વખતે જ સત્તાધીશોએ મક્કમ વલણ લેવાની જરૂર હતી. આપણે ત્યાં કોઈ પણ નક્કી કરવા માટે સેન્સર બોર્ડ છે. સેન્સર બોર્ડમાં સરકારે નીમેલા શાણા માણસો બેઠા હોય છે ને એ લોકો સાગમટે બેસીને કોઈ પણ ફિલ્મને સર્ટિફિકેટ આપવં કે નહીં એ નક્કી વ્યવસ્થાને સરકારે માન આપવાનું

કમનસીબે આપણે ત્યાં બધા લેવાતા હોય છે તેમાં મોકાણ મંડાઈ. ભાજપને રાજપુતોની મતબૅક્રની ચિંતા હતી તેથી તેણે આ કકળાટને હવા જ

websites at www.bseindia.com.

Place : Ahmedabad Date : January 25, 2018

ના આપી પણ 'પદ્માવત'નો વિરોધ કરનારાંના પગમાં જ આળોટી ગયો. ઘણે ઠેકાણે તો ભાજપના આગેવાનો જ વિરોધ કરવામાં સૌથી આગળ હતા ને તેમણે ભારતીય સંસ્કૃતિના નામે ઠોકાઠોક ચલાવીને આ વિરોધને વધારે ઉગ્ર બનાવ્યો.

સુત્રો દ્વારા મળતી માહિતીના આધારે

'પદ્માવત'નો કકળાટ શરૂ થયો એ વખતે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની ધમાધમી ચાલતી હતી ને એ વખતે ભાજપ સિદ્ધાંતોની ને નિયમોના પાલનની વાત કરવા જાય તો વંકાયેલા ક્ષત્રિયો બેન્ડ બજાવી દે તેના કારણે ગુજરાતમાં ફિલ્મ રિલીઝ નહીં કરવા દેવાય એવું એલાન કરી દેવાયું. ભાજપ શાસિત મધ્ય પ્રદેશ, છત્તીસગઢ ને રાજસ્થાનમાં આ વરસના અંતમાં વિધાનસભાની ચૂંટણી છે ને ભાજપ માટે કપરાં ચઢાણ છે તેથી ત્યાં પણ ભાજપ રાજપૂતોને નારાજ કરવા નહોતું માંગતો તેથી આ રાજ્યોમાં પણ 'પદ્માવત' રીલીઝ નહીં કરવા દેવાય એવું એલાન કરી દેવાયું.

ભાજપ શાસિત ચાર રાજ્યો 'પદ્માવત' રીલીઝ નહીં થવા દેવાય

For Radhe Developers (India) Limited

Mukesh Chaudhan

Company Secretary

એવું વલણ લે ને ભાજપ શાસિત બીજાં રાજ્યો જુદું વાજું વગાડે તો પણ ભાજપ અળખામણો સાબિત થાય એટલે પછી હઈસો હઈસો ચાલ્યું ને ભાજપ શાસિત બધાં રાજ્યોએ 'પદ્માવત' રીલીઝ નહીં કરવા દેવાય એવું જાહેર કરી દીધું. એ પછી તો સંજય લીલા ભણશાળીએ રાજપૂતોને રાજી કરવા નામ બદલીને 'પદ્માવત' કરી નાંખ્યું ને ફિલ્મમાં ફેરફારો પણ કરી નાંખ્યા પણ રાજપતો ઉકળેલા જ છે તેથી ભાજપ શાસિત રાજ્યોએ ઝાલેલું પૂંછડું છોડ્યું નહીં. આ રાજ્યોએ શરૂઆતમાં જ આકરું વલણ લીધું હોત ને સેન્સર બોર્ડ કહેશે એમ થશે તેવી સીધી ને સટ વાત કરી નાંખી હોત તો આ મોકાણ ના થઈ હોય. એ વખતે ચંટણીના કારણે ભાજપે હવા આપી તો ભલે આપી પણ કરીને કકળાટ કરનારાંને છૂટો દોર પણ એ વિરોધ 'પદ્માવત ચલેગા તો સેન્સર બોર્ડે ફિલ્મને મંજૂરી આપી એ પછી પણ તેમણે નિયમોના પાલનની વાત કરી હોત તો વાંધો નહોતો પણ તેના બદલે તેમણે પ્રતિબંધ ઠોકી દીધા. એ લોકોએ બીજા કોઈની પાસેથી નહીં પણ ભાજપના જ યોગી આદિત્યનાથ પાસેથી પ્રેરણા લીધી હોત તો પણ આ હાલત ના થઈ હોત. યોગી પણ પહેલાં 'પદ્માવત' રિલીઝ કરવા નહીં દેવાય એ જ ભાષા બોલતા હતા પણ જેવું ભણશાળીએ ફિલ્મનું નામ બદલી નાંખ્યું ને પાંચેક મોટા ફેરફારો કરી નાંખ્યા કે તરત યોગીએ એ સ્વીકારી લીધું. યોગીએ સામેથી જાહેર કરી દીધું

કમનસીબી એ કહેવાય કે, ક્રકરવાદી લાગતા યોગી આદિત્યનાથને જે વાત સમજાઈ એ વાત ભાજપ શાસિત રાજ્યોના સુધરેલા ગણાતા મુખ્યમંત્રીઓને ના સમજાઈ. એ લોકો 'પદ્માવત'ના વિરોધનું પૂંછડું ઝાલીને બેઠેલા લોકોની કુર્નિશ બજાવતા રહ્યા ને તેમની સામે મુજરા કરતા રહ્યા છે. આ લોકોએ એ પણ ના વિચાર્યું કે, 'પદ્માવત' ફિલ્મના

કે, હવે ફિલ્મ બતાવવામાં કશો વાંધો

છે જ નહીં.

સરકારોની છે તેના કારણે હવે તેમણે જખ મારીને ફિલ્મ રિલીઝ તો કરવા દેવી જ પડશે પણ સાથે સાથે નાકલીટી એ અલગ વાત છે પણ સૈદ્ધાંતિક રીતે સુપ્રીમ કોર્ટે આ રાજ્યોને તેમની હૈસિયત બતાવી દીધી છે. હસવું તો એ જોઈને આવે કે, સુપ્રીમ કોર્ટે તેમને અક્કલના મહાઓ એવી રેકર્ડ વગાડે

નિર્માતા સુપ્રીમમાં જશે ને ત્યાં આપણી છે કે, સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ઈક્ષ્ટતનો ફાલુદો થઈ જશે. રાજ્ય અભ્યાસ કરીને શું કરવું એ નક્કી સરકારોને કોઈ પણ ફિલ્મ પર કરીશું. ભલા માણસ, આમાં અભ્યાસ પ્રતિબંધની સત્તા જ નથી એ જોતાં કરવા જેવું કશું છે જ નહીં. તમારે સુપ્રીમ કોર્ટમાં આ પ્રતિબંધ બે ભણશાળીને ભઈબાપા કરીને ખભે મિનિટમાં ઊડી જશે એટલો વિચાર ઊંચકવાના છે ને તેની ફિલ્મને રિલીઝ પણ એ લોકોએ ના કર્યો. તેના કારણે 🛮 થવા દેવાની છે. સુપ્રીમ કોર્ટે તમને એ લોકો હાસ્યાસ્પદ તો ઠર્યા જ પણ તમારી ઔકાત શું છે તેનો અહેસાસ સાથે સાથે ભેરવાઈ પણ ગયા. સુપ્રીમ કરાવી દીધો છે. જોકે જે લોકો હજુય કોર્ટે સાફ શબ્દોમાં કહી દીધું છે કે, સમજયા નથી તેમની પાસે હજુય સમય કોઈ પણ ફિલ્મ સુખરૂપ રીલીઝ થાય 🛮 છે. 'પદ્માવત' રિલીઝ થવા આડે હજુ એ જોવાની જવાબદારી રાજ્ય એક અઠવાડિયું બાકી છે ને આ અઠવાડિયામાં ઘણું કરી શકાય. ભારત લોકશાહી દેશ છે ને લોકશાહી દેશમાં બધાંને વિરોધ કરવાનો અધિકાર છે. તાણીને તેને સુરક્ષા પણ આપવી જેમને 'પદ્માવત' સામે વાંધો છે એ પડશે. આ રાજ્ય સરકારો લબાડી લોકો વિરોધ કરે તેમાં કશું ખોટું નથી આપીને 'પદ્માવત'ની બેન્ડ બજવા દે 🛮 દેશ જલેગા' ટાઈપનો ના થાય તેનો જડબેસલાક બંદોબસ્ત તેમણે કરવો જોઈએ. અત્યાર લગી જે કંઈ કર્યું તેનું તેમણે પ્રાયશ્ચિયત કરવું જોઈએ ને આ દેશમાં સાચી લોકશાહી ચાલે છે. કોડીના કરી નાંખ્યા એ પછીય આ ઠોકશાહી નહીં એ સાબિત કરવું

SUNGOLD CAPITAL LTD

[CIN: L65910GJ1993PLC018956] Regd off: House no. 7/13, opp White Tower, Station Road, Nandod, Rajpipla, Narmada – 393145. Corporate Off: B/618, 6th Floor, Jaswanti allied Business Centre, off: Ramchandra Lane extn, Malad (west), Mumbai - 400064

Website: www.sungoldcapitallimited.com Email: info@sungoldcapitallimited.com

NOTICE is hereby given that pursuant to regulation 47 read with Regulation 29 & 33 of SEBI (Listing Obligation and Disclosure Requirements), Regulations, 2015 that the meeting of the Board of Directors of the Company will be held on Tuesday, February 13, 2018 at the Corporate office of the Company inter alia, to consider and approve the Unaudited Financial Result for the quarter ended December 31, 2017.

For Sungold Capital Ltd

Place: Mumbai Date: 25.01.2018 (Company Secretary & Compliance Officer

CS Sowjanya Poojary

SACHETA METALS LIMITED CIN: L27100GJ1990PLC013784

Regd. Office: Block No.33, Sacheta Udyognagar Village: Mahiyal, Ta: Talod, Dist. Sabarkantha. Gujarat-383215 Email: - investors.grivences@sacheta.com sachet@sacheta.com,PH:- 02770-221739, 221239

RADHE DEVELOPERS (INDIA) LIMITED

CIN: L45201GJ1995PLC024491

Regd. Office: 1st Floor, Chunibhai Chambers, Behind City Gold Cinema, Ashram Road, Ahmedabad-380009

Phone: +91 79-26583381 | Website: www.radhedevelopers.com |

E-mail: secretarial@radheinfra.com

Pursuant to Regulation 29 read with Regulation 47 of the Securities and

Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 (Listing Regulations), Notice is hereby given that a meeting of the Board of Directors of the Company is scheduled to be held on **Friday**,

February 2, 2018, inter alia, to consider and approve Un-Audited Financia

Results of the Company for the quarter and Nine-Months ended on December

The said Notice may be accessed on the Company's website a

www.radhedevelopers.com and may also be accessed on the Stock Exchange

Pursuant to this, the Company has decided that the close period (i.e. closure of

trading window) would commence from 6:00 p.m. on January 25, 2018

and end 48 hours after the results are made public on February 2, 2018.

Pursuant to the provisions of Regulation 47 read with Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulation, 2015, notice is hereby given that a meeting of the Board Of Directors of the Company is scheduled to be held or Wednesday the 07th February, 2018 to consider and approve inter alia, the Unaudited financial results for the quarter ended 31st December, 2017.

Further, in terms of the SEBI (Prohibition of Insider Trading) Regulations, 2015 read with Company's Code of Conduct, the Trading Window for dealing in the securities of the Company shall remain closed from 31st January, 2018 to 09th February, 2018 (both days inclusive) for the director/officer/designated Persons of the

For, Sacheta Metals Limited

Date: - 25.01.2018 Place: - Mahiyal

Satishkumar Shah Managing Director

પ્રતિકાત્મક કબ્જા નોટીસ ICICI Bank

રજીસ્ટર્ડ ઓફિસ : આઈસીઆઈ બેંક ટાવર,ચકલી સર્કલ પાસે, જુના પાદરા રોડ, વડોદરા- ૩૯૦૦૦૭, ગુજરાત કોર્પોરેટ ઓફિસ : આઈસીઆઈ બેંક ટાવર્સ, બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્ષ, બાંદ્રા (ઈ) મુંબઈ -૪૦૦૦૫૧

આથી સિક્યુરાઇઝેશન રિકંસ્ટ્રક્શન ફાઇનાન્સ એસેટ એન્ડ ઇનફોર્મ્સમેન્ટ ઓફ સિક્યુરિટી ઓફ ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ અને સિક્યુરિટી ઇન્ટરેસ્ટ ઇન્ફ્રોર્સમેન્ટ ૨૦૦૨ની કલમ ૧૩(૧૨) તેની સાથે અનુચ્છેદ ૩ સાથે વાંચતા મળેલી સત્તાની રૂએ અહી નીચે સહી કરનાર સત્તાવાર અધિકારીએ નીચે જણાવેલ લોકોને માંગણા નોટીસ આપી છે. આ નોટીસ આપ્યાથી ૬૦ દિવસની અંદર અહી દર્શાવેલા નાણાં ભરી જવા જણાવવામાં આવે છે.

કરજદારો નાણાં ચૂકવવામાં નિષ્ફળ ગયા છે, આથી કરજદારો અને સામાન્ય જનતાની જાણ માટે નીચે જણાવેલા અધિકારીએ અહી જણાવેલી મિલ્કતનો પ્રતિકાત્મક કબ્જો જણાવેલ તારીખે લીધો છે જે કલમ ૧૩ (૪) અનુચ્છેદ ૮ સાથે વાંચતા મળેલી સત્તાની રૂએ કાર્યવાહી કરી છે. કરજદારો અને સામાન્ય જનતાને આથી ચેતવણી આપવામાં આવે છે કે આઈસીઆઈસીઆઈ બેંક લિમીટેડ પાસે આ

ક્રમ નં.	. કરજદારનું નામ / લોન એકાઉન્ટ નંબર	મિલ્કતની વિગત / પ્રતિકાત્મક કબ્જાની તારીખ	ડિમાંડ નોટીસની તારીખ / ડિમાંડ નોટીસની ૨કમ (રૂ)	શાખાનું નામ
٩.	હીરાભાઈ નાનુભાઈ દેસાઈ/ કાંતાબેન હીરાભાઈ રબારી- LBPAA00001852280	પ્લોટ નં. ૨૫, બ્લોક નં. ૧૬ ગોવરધન ટાઉનશીપ, રાજપુત છાત્રાલય પાસે, પાર્થ રેસિડેન્સી, ટી.પી. સ્કીમ -૧, એટ કેનાલ રોડ, ગામ- ગંગાદીપતી, પાટણ- ૩૮૪૨૬૫/૨૨ જાન્યુઆરી, ૨૦૧૮.	૦૬ જુલાઈ,૨૦૧૭ રૂા. ૯,૧૪,૦૨૧.૬૮/-	પાટણ

અને ૯ સિક્યુરિટી ઇન્ટરેસ્ટ (ઇન્ફોર્સમેન્ટ) રૂલ્સ ૨૦૦૨ની જોગવાઈ મુજબ જામીન તરીકે મુકેલી મિલ્કત આ નોટીસ પ્રસિદ્ધ થયાનાં ૩૦ દિવસ આથોરાઇઝ્ડ ઓફિસર તારીખ: ૨૫ જાન્યુઆરી, ૨૦૧૮ આઈસીઆઈસીઆઈ બેંક લીમીટેડ સ્થળ : પાટણ

. ઉપર જણાવેલા કરજદાર(રો) /જામીનદાર(રો) અહી બાકી નાણાં પરત કરી જવામાટે ૩૦ દિવસની નોટીસ આપવામાં આવે છે.નહીં તો કલમ ૮